

Ref: SEL/2020-21/52

November 14, 2020

To,
The Dy. Gen Manager
Corporate Relationship Dept. **BSE Limited**PJ Tower, Dalal Street,
Mumbai- 400 001

Equity Scrip Code:532710

To, National Stock Exchange of India Ltd. Exchange Plaza, Plot no. C/1, G Block, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai - 400 051

Equity Scrip Name: SADBHAV

Fax: 022-26598237-38

Sub: Intimation about Newspaper advertisements for dispatch of Notice of Postal Ballot

Dear Sir/ Madam,

In terms of Regulation 30 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015 and other applicable provisions, we hereby enclosed copies of the Newspaper advertisements were published on November 14, 2020 in English language (The Economic Times) and in Regional language (Financial Express) in Ahmedabad Edition in respect of Dispatch of Postal Ballot Notice to Shareholders by electronic means only.

Please find attached the copies of the aforesaid advertisements and also made available on the Company's website at www.sadbhaveng.com.

You are requested to take the above on your record.

ENGINEE

Thanking You,

Yours Faithfully,

For Sadbhav Engineering Limited

hunstul.

Tushar Shah Company Secretary Mem. No. F7216

Encl: As Above

TECHNICAL PAPER ON

DOMESTIC SUPPORT

ANALYSE ALL MEM-

BERS' PER-FARMER

FARM SUPPORT

SINCE 1995

BASED ON

PER FARMER

ASKS WTO TO

THUMBNAILS

14/11/2020: THE ECONOMIC TIMES: AHMEDABAD

Economy: Macro, Micro & More

The Economic Times, Ahmedabad, Saturday, 14 November 2020

FARM SUBSIDIES

India for Support-Per-Farmer Rule at WTO, Level Playing Field

Country suggests getting rid of trade-distorting subsidies given by the developed nations

Kirtika.Suneja@timesgroup.com

New Delhi: India has countered a proposal by the US, EU, Australia and others that seeks to reduce the farm subsidies given by countries with higher potential to distort global markets. On this "proportionality principle", it said the new negotiations on domestic support must be based on a "support per farmer" basis and not be defined in aggregate terms.

Besides, the first step of the negotiations at the World Trade Organization (WTO), India said, is to crea-

India said that domestic support 10% of the value of production but who did not wish to be identified. The 47-member G-33 coalition supported India's ideas.

farm subsidies "On the proportionality principle, hold caps the domestic support at severe impact on market uncerta-

> production. The US, EU and Canada give \$160 butions. It said agriculture reform distortions in the past making the

farm subsidies given by the develo- of reverse special and differential

distort to take ing form of

Setting Proportions

US, EU,

Canada give

trade-distort-

\$160 billion

INDIA PROPOSES SUPPORT-PER-FARMER RULE FOR FARM SUBSIDIES AT WTO

Australia, EU

As per the official, India also said a farm subsidies to products inclusue but also a food security issue. tea level playing field by getting rid level playing field can be created by ding cotton, wool and tobacco, acof the aggregate measurement of getting rid of AMS entitlement be-cording to a submission by India support (AMS) or trade-distorting yond de minimis and that it is a form and China.

India has maintained that AMS treatment. De minimis or the thres- above de minimis has had a more official. inty compared to de minimis entitmust be based on a 'support per far-many developed countries have en-lements. Therefore, its elimination mer' basis, not be defined as sum to- titlements to provide domestic sup- is necessary to enable all members provided by WTO members from tal," said a Geneva-based official, port well over 10% of the value of to start on an equal footing before 1995 to the present be done, with talking about proportional contri- those responsible for the biggest

"India will work with other interested members to put forth a technical submission on domestic support based on perfarmer terms," said the

India also suggested that an anaagriculture support that has been billion of trade-distorting form of is not only an import and export is-biggest contribution.

DIPAM Seeks Higher, Quarterly Dividends from State-owned Cos

Says staggered payments will free up resources during last quarter of fiscal year

Our Bureau

ve overhaul in the dividend distribution policy of central public sector enterprises (CPSEs), the Department of Investment and Public Asset Management (DIPAM) has sis quarterly as opposed to minifinancial year and also kindle in- considering paying the minimum vestor interest in stocks of CPSEs, improving market sentiment for

arterly dividend payments would

to give higher dividend payouts At least 90% of DIPAM asks CPSEs dividend in one or | to give quarterly

Better Payouts

New Delhi: Eyeing a comprehensi- firmed up," the department said in "CPSEs are advised to strive payhigher dividends on a staggered ba- account relevant factors like profimum dividends on an annual basis. due leveraging, cash/reserves and Staggered dividend payment re- net worth," the DIPAM said in an gime would free up resources pay- advisory dated November 9, adable during the last quarter of the ding that several CPSEs were only

an advisory sent out to CPSEs. The move comes in the backdrop of weak revenues, hit by Covid-19 induced economic slowdown.

more instalments

ing higher dividends taking into tability, capex requirements with dividend as per the guidelines. The department asked all CPSEs

to consider giving "at least 90% of "Predictability in regular or qu-the projected annual dividend in attract quality investors to CPSE rim dividend. It also cautioned stocks and retain them in the hope companies that pay higher diviof a future dividend. Government dends that the interim dividend would also get predictable and pe-should be issued every quarter afriodic dividends as interim dividends before Budget estimates are giving it towards the end of the fi-

Benefits of quarterly dividends... Would free up resources payable during Q4 quality dividend investors to for govt CPSE stocks

nancial year. "Such bunching of interim dividend payouts by CPSEs in February-March may compete with their cash availability for the year-end payments to suppliers as well as towards advance tax," said the advisory. Higher dividend refers to 100% of the dividend or 10 per sha-

> Some companies can also consi der paying the dividend on a halfyearly basis, but those who cannot pay the minimum prescribed interim dividend should pay it annually during October or November each year based on projected profit after tax, with the declaration of

> If any balance payout is remai-CPSE should provide it in September, after the annual general mee-

SADBHAV ENGINEERING LIMITED ICIN: L45400GJ1988PLC0113221

Reg. Office: - 'Sadbhav House' Opp. Law Garden Police Chowki, Ellisbridge Ahmedabad-380006, Gujarat. Tel: 91 79 40400400, Fax: 91 79 40400444, E-mail: investor@sadbhav.co.in, Web: www.sadbhaveng.com

NOTICE OF POSTAL BALLOT TO MEMBERS

Members of Sadbhav Engineering Limited (hereinafter referred to as "the Company" are hereby informed that Pursuant to the provisions of Section 108 and Section 110 of the Companies Act, 2013 and Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs dated No. 14/2020 dated April 08 2020, Circular No. 17/2020 dated April 13, 2020 and Circular No. 20/2020 dated May 05, Circular No. 22/2020 dated June 15, 2020, Circular No. 33/2020 dated September 28, 2020 and Securities Exchange Board of India, vide its circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 ("Circulars"), all other applicable laws and circulars issued by the Ministry of Corporate Affairs (MCA), Government of India and Securities and Exchange Board of India, that the approval of the members of the company is being sought through a Postal Ballot (only through remote e-voting) for the following business to be passed by way of Ordinary Resolution:

1. Re-classification of Mr. Vipul H. Patel, Mr. Girishbhai N. Patel, Mrs. Rajshree Primtam Patel, Mrs. Truptiben Nileshbhai Patel from "Promoter and Promoter Group" category to "Public" category

The Board of Directors of the Company has appointed Mr. Ravi Kapoor, Practicing Company Secretary and Proprietor of M/s. Ravi Kapoor & Associates (Membership No. FCS-2587) ("Scrutinizer"), as a Scrutiniser for conducting the Postal Ballot in fair and transparent manner. As required under LODR Regulations, the Company has engaged the services of Central Depository Services (India) Limited ("CDSL") to provide electronic voting facilities to the Members of the

Members of the Company holding shares either in physical form or dematerialized form as on cut-off date i.e. Sunday, November 8, 2020 may cast their vote electronically upto Monday, December 14, 2020, 5.00 p.m. The remote e-voting facility shall be disabled for voting thereafter.

In case of non-receipt of Notice of Postal Ballot, a member as on cut-off date i.e. November 08, 2020, can download the same from the website of the Company viz. www.sadbhaveng.com or website of CDSL viz. www.evotingindia.com or apply to the Company.

The detailed procedure instructions for remote e-voting forms part of the Posta Ballot Notice are as follow:

1. Date of completion of dispatch of the November 13, 2020 Postal Ballot Notice by e-mail to those shareholders who have registered their e-mail id with the Company/Depositories/Registrar and Transfer Agent (RTA), However, in view of the continuing COVID-19 pandemic, Hard copy of the Postal Ballot Notice along with Postal Ballot Form and pre-paid business reply envelope will not be sent to the members for this Postal Ballot and

Shareholders are required to communicate their assent or dissent through the remote e-voting systems 2. Date & Time of commencement of | 09.00 a.m. on Sunday, November 15

Date & Time of end of remote 5:00 p.m. on Monday, December 14 Cut-off date for determining rights of Sunday, November 08, 2020 members to vote shall be reckoned Notice of Postal Ballot is available on | www.sadbhaveng.com; Company's website & on CDSL

Any queries or grievances pertaining Mr. Tushar Shah, Company to Postal Ballot Any queries or grievances pertaining In case you have any queries or issues

to e-voting

Place: Ahmedabad

Date: November 13, 2020

Depository Services (India) Limited, A wing, 25th Floor, Marathor Futurex, Mafatlal Mill Compounds, N.M. Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an e-mail to helpdesk.evoting @cdslindia.com or call 1800225533. The result of the postal ballot through e-voting will be declared / announced

on Wednesday, December 16, 2020 at the Corporate Office of the Company situated at 'Sadbhav', Near Havmor Restaurant, B/H Navrangpura Bus Stand, Navrangpura, Ahmedabad-380009, Gujarat. The result along with Scrutinizer Report will be posted on the Company's website viz. www.sadbhaveng.com and on CDSL's website viz. www.evotingindia.com besides communicating to the Stock Exchanges where the shares of the Company are listed.

> By Order of the Board of Sadbhav Engineering Limited, **Tushar Shah Company Secretary** Mem. No. F7216

www.evotingindia.com

Tel.: 079 40400400

call 1800225533.

Email: investor@sadbhav.co.in

regarding e-voting, you may refer the

Frequently Asked Questions ("FAQs"

and e-voting manual available a

www.evotingindia.com, under help

section or write and e-mail to

helpdesk.evoting@cdslindia.com or

All grievance connected with the

facility for voting by electronic

means may be addressed to Mr

Rakesh Dalvi, Manager, Central

Cabinet Note Likely on Aatmanirbhar Bharat Rozgar Yojana in Next 15 Days

Yogima Seth Sharma & Deepshikha Sikarwar

New Delhi: Looking to swiftly roll out the Aatmanirbhar Bharat Rozgar Yojana that's aimed at creating jobs, the lasecure the cabinet's approval, a top government official told ET. "The cabinet note will be moved in the

work had begun on framing the rules for the scheme that will be issued soon after. Finance minister Nirmala Sitharaman on Thursday announced the Aatmanirbsures to lift the economy hit hard by the Covid-19 pandemic, including the sche-

Yojana available to all entities registered with the Employees Provident Fund Organisation, the government will provide based on data as of September 2020. the provident fund contributions of both the employees and employers for two ye- 2021

Particulars

Total income from operations (net)

Net Profit / (Loss) for the period (before tax,

Net Profit / (Loss) for the period before tax

Net Profit / (Loss) for the period after tax

(After Exceptional and/or Extraordinary items)

(After Exceptional and/or Extraordinary items)

Total Comprehensive Income for the period

Reserves (excluding Revaluation Reserve as

shown in the Balance Sheet of previous year)

items) (of Rs.10/ each) basic and Diluted EPS

Earnings Per Share (before extraordinary

Equity Share Capital

(www.macpowercnc.com)

Place: METODA/RAJKOT

Date: 13.11.2020

Exceptional and/or Extraordinary items)

A HELPING HAND

Under Aatmanirbhar Bharat Rozgar Yojana, the govt will bour ministry will soon move a note to provide PF contributions of both employees and emplonext 15 days," the official said, adding that yers for two years for new hires drawing up to ₹15,000

har Package 3.0 containing a dozen mea- up to Rs 15,000 per month. For an establishment with 50 employees, a precondition for the benefit is adme to generate employment. ding a minimum of two jobs and for tho-Under Aatmanirbhar Bharat Rozgar se with more than 50 employees, a minimum of five jobs need to be added. Calculation of employee strength will be

ars for any new hires drawing salaries of The rules being framed will deal with is-

MACPOWER CNC MACHINES LIMITED

Registered Office: Plot No.2234, Nr. Kranti Gate, Gidc Metoda,

CIN: L30009GJ2003PLC043419

Extract of Unaudited Financial Results for the

quarter and half year ended 30/09/2020

For quarter ended

30.09.2020 30.09.2019

2149

119

119

-2

1000

0.88

Note: The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed

with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure

Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results

are available on the Stock Exchange websites (www.nseindia.com) & on Company's website

2222

202

200

-2

2.00

The scheme is applicable until June 30,

sues such as how the benefit will accrue if an employee leaves in the middle of the two-year period, the official added. The scheme will cost the government

Rs 6,000 crore this year, but the total expenditure is expected to be about Rs 25,000 crore, the official added. "As per EPFO data, if we purely go by current trends, we believe that almost 15-20 lakh employees will get benefited from this scheme by March 2021," SBI Research said in a note. The nationwide lockdown imposed to

contain the Covid-19 spread and the subsequent economic slowdown led to large job cuts across sectors. The latest scheme is expected to aid hiring by companies and address the situ-

The Centre for Monitoring Indian Eco-

nomy's data shows that the employment rate in the country was at a low of 37.8% in October and 0.55 million jobs were lost last month. This came after a partial recovery following the loss of 121 million jobs in April.

(Rs. In Lakh)

Year

ended

31.03.2020

8198

391

391

273

-10

981

5663

2.73

Rupesh Mehta

Managing Director

Half year

ended

30.09.2020

65

134

1.34

For Macpower CNC Machines Limited

Italian Defence Firms Eyeing Joint Production With India, says Envoy

@timesgroup.com

New Delhi: Italian defence companies are ready to explore cooperation with Indian firms for joint manufacturing of equipment and transfer of technology, Italian envoy to India Vincenzo de Luca said, close on the heels of the November 6 bilateral Summit

"The success of the 6 November Italy-India Virtual Summit is underpinned by the conclusion of 15 agreements. Some of those are in the defence industry sector. In particular, our national champion in shipbuillandmark Summit.



which took the twin hits of the AgustaWestland scam and the Italian marines case — were revived after an eight-year gap in 2018. Prior to the banning of Italy's Finmeccanica (now Leding, Fincantieri, inked two onardo), which owned UK-ba-MoUs with Cochin Shipyard sed AgustaWestland, in 2013 in Ltd on design, shipbuilding, the aftermath of the VVIP manufacturing and repair/re- chopper scandal, Italy had sigfit," the ambassador told ET in nificant interests in the Indian an interaction, days after the defence sector, ranging from maritime systems to radars, Defence ties with Italy - avionics and land systems.

Tal. Lodhika, Dist. Rajkot-360007, Gujarat. NEHRU MEMORIAL MUSEUM AND LIBRARY Web: www.macpowercnc.com, E-Mail - cs@macpowercnc.com TEEN MURTI HOUSE, NEW DELHI 110011

An Autonomous body under Ministry of Culture Nehru Memorial Museum and Library (NMML) is developing Museum on Prime Ministers in the Teen Murti complex.

NMML invites E-bids for the following

MOPM/RFP/2020/006V2

Supply of Hardware & Software of Indoor Positioning System based Audio Guide MOPM/RFP/2020/07 Execution of Galleries for all Exhibits of

Museum on Prime Ministers The last date for submission of e-bid is 5th December, 2020 up to 17.00 hrs (IST). For more details please visit website www.tenderwizard.com/NMML, www.eprocure.gov.in.

davp 09142/11/0001/2021

INVITATION FOR BIDS NATIONAL HYDROLOGY PROJECT

The Executive Engineer, Burdwan I&P Division, I & W Departmen Govt. of W.B, invites Bids which shall be submitted in the e-Procurement Portal for the following work circulated vide T.O. No-458/NHP-02/02, Dt.-13.11.2020: "Construction of Regional Data Center At Purulia Bhatbandh Irrigation Colony Office Complex Dist - Purulia , Under NHP". NIQ No.-WBIW/NHP/IFB-05/2020-21 Detailed Invitation for Bid is available on www.wbiwd.gov.in. The Bidding Document can be downloaded free of cost by logging on to the website www.wbtenders.gov.in. The deadline for submission of Bid is 15.12.2020 at 15:00 hours.

> **Executive Engineer Burdwan Inv. & Planning Division**

THE FERTILISERS AND CHEMICALS TRAVANCORE LIMITED (A Government of India Enterprise) XORPORATE MATERIALS. PD ADMINISTRATIVE BUILDING. UDYOGAMANDAL P.O., ERNAKULAM DIST. KERALA STATE. INDIA. PIN-6835 Phone: 0484-2568646, 2546427 Fax: 0484-2545998; email: chidambaram@factltd.con E TENDER for FABRICATION OF BULLET TANKS

TENDER No. MM/172/E22446 Dated 12-11-2020 (CPP tender ID 2020 FACT 596936 1) competitive, Single stage Two Bid Tenders are invited from reliable and experienced contractors of sound financial standing for Fabrication & SUPPLY of 4 nos. Bullet tanks for the transportation of Liquified Ammonia gas (LAG) in Barge.

Pre Bid Meeting: from 10.30 A.M. on 26-11-2020 at FEDO Conference Hall at Udyogamandal, Kochi. Interested parties may visit Central Public Procurement Portal (http://eprocure.gov.in) for tender details and further updates on the Tender including extension of due date, if any. No further News Paper Advt. shall be given. Tender is also available in www.fact.co.in. Due date/time for submission of bids: 14-12-2020/2.00 p.m.

Dv. GENERAL MANAGER (MATERIALS)

BM-II DIVISION, CIVIL ENGINEERING DEPARTMENT NEW DELHI MUNICIPAL COUNCIL

322, 3rd FLOOR, SHAHEED BHAGAT SINGH PLACE **GOLE MARKET, NEW DELHI-110001** e-procurement Tender Notice

Sub:- Proposed Bus Terminus cum Commercial Complex near Shivaji Stadium. SH: Construction of Bus Terminus Cum Commercial Complex near Shivaji Stadium. Rs. 52,82,84,838.00

Date of release of tender through Date and time for pre-bid meeting in the office of CE(C-II) Palika Kendra on Last date/time for receipt of tenders through

: 17.11.2020 at 3.30P.M.

Note:- (i) To participate in e-tender in NDMC registration with application services provider (NIC) is (ii) Kindly note that any change shall be communicated only through e-procurement system.

ID: 2020_NDMC_ 196562_ 1 Estimated cost

Further details can be seen at https://www.govtprocurement.delhi.gov.in

SHASHANK TRADERS LIMITED

CIN: LS2110DL 1985PLC021076
Regd. Office: 702-A, Arunachal Building, 19, Barakhamba Road, Connaught Place, New Delhi-110001
Tele. No.: 011-4357104142; Fax: -011-43571047, Email Id: Info@shashankinfo.in; Website: www.shashank

UN	I-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AN See Regulation 47(1) (b) of the SEBI	ND SIX MONT (LODR) Reg	THS ENDED	SEPTEMBE	R 30, 2020 (Rs.In Lacs)
SI. No.		Quarter ended 30.09.2020	Quarter ended 30.09.2019	Half Year ended 30.09.2020 Unaudited	
1. 2.	Total Income from Operations	0.06	-	64.97	-
2. 3.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#) Net Profit / (Loss) for the period before tax	(1.54)	4.66)	6.96	(18.55)
	(after Exceptional and/or Extraordinary items#)	(1.54)	(4.66)	6.96	(18.55)
4. 5.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#) Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after	(1.13)	(4.66)	5.15	(19.51)
6. 7.	tax) and Other Comprehensive Income (after tax)] Equity Share Capital Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of	(1.13) 309.38	(4.66) 309.38	5.15 309.38	(19.51) 309.38
8.	the previous year Earnings Per Share (for continuing and discontinued operations) -	-	-	-	(23.64)
	1. Basic: 2. Diluted:	(0.04) (0.04)	(0.15) (0.15)	0.17 0.17	(0.63) (0.63)

Nipun Jain Director DIN:- 05289775 Date: 13/11/2020

W

TATA POWER DELHI DISTRIBUTION LIMITED A Tata Power and Delhi Government Joint Venture Regd. Office: NDPL House, Hudson Lines, Kingsway Camp, Delhi 110 009
Tel: 66112222, Fax: 27468042, Email: TPDDL@tatapower-ddl.com
CIN No.: U40109DL2001PLC111526, Website: www.tatapower-ddl.com

NOTICE INV	ITING TE	NDERS	Nov 14, 2020	
TATA Power-DDL invites tenders as per	following deta	ails:		
Tender Enquiry No. Work Description	Estimated Cost/EMD (Rs.)	Sale of Bid Document	Last Date & Time of Bid Submission Date and time of Opening of bids	
TPDDL/ENGG/ENQ/200001252/20-21 RFx-5000001918 Rate contracts for AMC of IP Phones installed across various locations in Tata Power-DDL	40.38 Lac 1.00.950 Lac	14.11.2020	05.12.2020;1500 Hrs. 05.12.2020;1700 Hrs.	
TPDDL/ENGG/ENQ/200001256/20-21 RFx- 5000001924 RC for Street Light Materials	2.36 Cr./ 2.77 Lac	14.11.2020	05.12.2020;1700 Hrs. 05.12.2020;1730 Hrs.	
*EMD as per Revised Guidelines for short term power vide resolution dated 30th March 2016, t				
CORRIGENDUM / T	ENDER DA	TE EXTE	NTION	

CORRIGERDOW / TEN	IDEK DATE	EXTENTION
Tender Enquiry No. Work Description	Previously Published Date	Revised Due Date & Time of Bid Submission/ Date & time of opening of bids
TPDDL/ENGG/ENQ/200001249/20-21 Rfx- 5000001906 Design, Supply, Testing and Commissioning of RTUs and IEDs in Tata Power DDL	21.10.2020	27.11.2020; 1600 Hrs/ 27.11.2020; 1630 Hrs

Complete tender and corrigendum document is available on our website www.tatapower-ddl.com—→ Vendor Zone —→ Tender / Corrigendum Docum Contracts - 011-66112222

MPDL LIMITED

(Formerly Known as Monnet Project Developers Limited) Corporate Office: UNIT NO. 12, GF, MAGNUM TOWER-1 SECTOR - 58, GURUGRAM GURUGRAM 122011

Regd. Office: Plot No. 216, Sector - C, Urla Industrial Complex, Raipur (Chhattisgarh)-493221 Tel. No. 011-29218542-46; Fax: 011-29218541; e-mail: isc_mpdl@monnetgroup.com $website: www.monnetgroup.com; \quad \textbf{CIN}: L70102CT2002PLC015040$ STATEMENT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30th SEPTEMBER, 2020

Г	STATEMENT OF STANDALONE AND CO											xcept per s	,
Γ				Standalone				Consolidated					
SI.	Particulars	Q	uarter ende	d	Half year	ended	Year Ended	c	uarter ende	d	Half yea	ar ended	Year Ended
INO	,	30.09.2020	30.06.2020	30.09.2019	30.09.2020	30.09.2019	31.03.2020	30.09.2020	30.06.2020	30.09.2019	30.09.2020	30.09.2019	31.03.2020
L		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total income from operations (net)	91.60	13.35	-	104.95	-	566.27	91.60	13.35	-	104.95	-	566.27
2	Net Profit / (Loss) for the period (before Tax,												
١.	Exceptional and/or Extraordinary items)	(72.67)	65.05	(44.47)	(7.62)	(103.15)	(230.06)	(72.67)	65.05	(44.47)	(7.62)	(103.15)	(230.06)
\int_{0}^{3}	Net Profit / (Loss) for the period before tax	(70.07)	05.05	(44.47)	(7.00)	(400.45)	(000.00)	(70.07)	05.05	(44.47)	(7.00)	(400.45)	(000.00)
L	(after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after tax	(72.67)	65.05	(44.47)	(7.62)	(103.15)	(230.06)	(72.67)	65.05	(44.47)	(7.62)	(103.15)	(230.06)
"	after Exceptional and/or Extraordinary items)	(72.67)	65.05	(44.47)	(7.62)	(103.15)	(230.06)	(72.67)	65.05	(44.47)	(7.62)	(103.15)	(230.06)
15	Total Comprehensive Income for the period	(12.01)	00.00	(/	(1.02)	(100.10)	(200.00)	(12.01)	00.00	(/	(1.02)	(100.10)	(200.00)
ľ	[Comprising Profit / (Loss) for the period												
l	(after tax) and Other Comprehensive												
l	Income (after tax)]	(72.67)	65.05	(44.47)	(7.62)	(103.15)	(230.06)	(106.60)	44.19	(48.51)	(62.42)	(72.09)	(190.48)
6	Reserves (excluding Revaluation Reserve)												
ı	as shown in the Audited Balance Sheet of						4 040 00						4 707 04
١,	the previous year Equity share capital (Face Value of	-	-	-	-	-	4,619.29	-	-	-	-	-	4,787.94
ľ	Rs.10/- per each)	741.25	741.25	741.25	741.25	741.25	741.25	741.25	741.25	741.25	741.25	741.25	741.25
18	Earnings Per Share (of Rs. 10/- each) (for	7 11.20	7 11.20	7 111.20	7 11.20	7 111.20	7 11.20	7 11.20	7 11.20	711.20	111.20	111.20	7 11.20
ľ	continuing and discontinued operations) -												
ı	(a) Basic	(0.98)	0.88	(0.60)	(0.10)	(1.39)	(3.10)	(1.44)	0.60	(0.65)	(0.84)	(0.97)	(2.57)
L	(b) Diluted	(0.98)	0.88	(0.60)	(0.10)	(1.39)	(3.10)	(1.44)	0.60	(0.65)	(0.84)	(0.97)	(2.57)

1) The above Unaudited Financial Results were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their meeting held on 13th November, 2020

The results for the guarter ended 30.09.2020 have been subject to a Limited Review by the auditors.

ý The above is an extract of the detailed format of Quarterly / Ánnual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosur Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Stock Exchanges website (www.bseindia.com) and Company websit www.monnetgroup.com

For MPDL LIMITED (Formerly Known as Monnet Project Developers Limited B.D. Bhardwa Whole Time Director

Place: New Delhi Date: 13.11.2020



एण्ड्र यूल एण्ड कम्पनी लिमिटेड

ANDREW YULE & COMPANY LIMITED (A Government of India Enterprise)
CIN: L63090WB1919G0I003229

Registered Office: "Yule House", 8, Dr. Rajendra Prasad Sarani, Kolkata-700 001, Ph.: (033) 2242-8210 / 8550, Fax No.: (033) 2242-9770, E-mail:com.sec@andrewyule.com, Website: www.andrewyule.com

Extract of the Unaudited Standalone and Consolidated Financial Results for the guarter and half-year ended 30th September, 2020

	(Rs. in lakhs except as otherwise stated)								
SL	Particulars		Standalon	е	Consolidated				
NO.	Tarriculars	3 Months Ended 30.09.2020	6 Months Ended 30.09.2020	Corresponding 3 Months Ended 30.09.2019	3 Months Ended 30.09.2020	6 Months Ended 30.09.2020	Corresponding 3 Months Ended 30.09.2019		
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)		
1.	Total income from operations (net)	14464.00	18177.97	11898.09	14464.00	18177.97	11898.09		
2.	Net Profit / (Loss) for the period before tax	4573.20	3657.08	1435.60	4572.70	3656.44	1435.60		
3.	Net Profit / (Loss) for the period after tax	4573.20	3657.08	1435.60	4422.12	3921.99	726.60		
4.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]		3656.05	1260.16	4421.09	3920.97	557.72		
5.	Paid-up Equity Share Capital (Face value Rs. 2/- per Equity Share)	9779.02	9779.02	9779.02	9779.02	9779.02	9779.02		
6.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of previous year	_	_	_	_	_			
7.	Earnings per Share (Face value Rs. 2/- per Equity Share) - Basic (Rs.)	0.94	0.75	0.29	0.90	0.80	0.29		
	- Diluted (Rs.)	0.94	0.75	0.29	0.90	0.80	0.29		

Notes:

 The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on 13th November, 2020.

2) The above is an extract of the detailed format of the Unaudited Standalone and Consolidated Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Standalone and Consolidated Financial Results for the quarter and half-year ended 30th September, 2020 are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company's website (www.andrewyule.com).

> For and on behalf of Andrew Yule & Company Limited (K Mohan)

For and on behalf of Andrew Yule & Company Limited (Sanjoy Bhattacharya)

Chairman & Managing Director

Place: Kolkata Date: 13th November, 2020

Director (Personnel) MEDICAMEN BIOTECH LTD.

ı	Regd. Office: 1506, Chiranjiv Tower, 43, Nehru Place, New Delhi- 110019 CIN: L74899DL1993PLC056594 E-mail: cs@medicamen.com, www.medicamen.com										
_	Extracts of Star	idalone and	Consolidat	ed Un-audit	ed Financia	ıl Results fo	r the Half Ye	ar ended o	n 30.09.2020)	(In Lakhs)
				Standalon	е				Consolidate	ed	
SI. No.	Particulars	Quarte	r Ended	Half yea	Half year ended		Quarter Ended		Half year ended		Year Ended
	Total income from operations (net)	Un-audited 30.09.2020	Un-audited 30.09.2019		Un-audited 30.09.2019	Audited 31.03.2020	Un-audited 30.09.2020	Un-audited 30.09.2019	Un-audited 30.09.2020	Un-audited 30.09.2019	Audited 31.03.2020
1	Total income from operations (net)	3090.38	3586.81	5710.31	6703.56	11925.09	3090.38	3586.81	5877.14	6703.56	12744.26
2	Net Profit/ (Loss) for the period (before tax, exceptional and/ or Extraordinary items)	460.02	521.93	765.29	953.70	1660.39	460.02	521.93	783.85	953.70	1798.02
3	Net Profit/ (Loss) for the period before tax (after exceptional and/ or Extraordinary items)	460.02	521.93	765.29	953.70	1660.39	460.02	521.93	783.85	953.70	1798.02
4	Net Profit/ (Loss) for the period after tax (after exceptional and/ or Extraordinary items)	322.36	383.72	532.85	711.85	1225.89	322.36	383.72	546.77	711.85	1329.12
5	Total comprehensive income for the period {Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive income (after tax)}	322.36	383.72	532.85	711.85	1225.89	322.36	383.72	546.77	711.85	1329.12
6	Equity Share Capital	1221.66	1221.66	1221.66	1221.66	1221.66	1221.66	1221.66	1221.66	1221.66	1221.66
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)										
8	Earnings Per Share (of Rs.5/- each) (for continuing and discontinued operation) Basic: Diluted:	2.64 2.64	3.18 3.18	4.36 4.36	5.89 5.89	10.09 10.09	2.64 2.64	3.18 3.18	4.48 4.48	5.89 5.89	10.94 10.94

Place: New Delhi

Date: 13.11.2020

- The un-audited financial statement for the quarter and half year ended September 30, 2020 have been reviewed by the Audit Committee and approved by the Board
- of Directors at its meeting held on November 13, 2020 The figures are regrouped in previous year also, wherever considered necessary
- Limited Review Report has been carried out by the Statutory Auditors for the above period

For Medicamen Biotech Limited Rahul Bishnoi Chairmar

ઝોનલ ઓફિસઃ ૨૦૧-૨૦૫, બી-બ્લોક રૂદ્ર આર્કેડ, ૧૩૨ કુટ, ડ્રાઇવ-ઇન-ક્રોસ રોડ મેમનગર,અમદાવાદ-૩૮૦૦૫૨ इंडियन बैंक 🦝 Indian Bank ટેલિ .: (૦૭૯) ૨૭૪૩૫૬૬૩ , ૨૭૪૩૧૨૪ ઇ-હરાજી ૨૧.૧૨.૨૦૨૦ ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યા થી બપોરે ૩.૦૦ વાગ્યા સુધી સરફેસી એક્ટ, ૨૦૦૨ હેઠળ જ્યાં છે, જે છે અને જેમ છેના ધોરણે સરફૈસી એક્ટ, ૨૦૦૨ હેઠળ જ્યાં છે, જે છે અને જેમ છેના ધોરણે વેબસાઇટ https://www.mstcecommerce.com પર આપેલ ઈ-હરાજી પ્લેટફોર્મ મારફત શ્રી આચાર્ચ યોગેન્દ્ર સ્વામી (भेंडना भोतिङ ङजन्न हेडणनी रेसीडेन्सीयल भिलङत) શ્રી આચાર્ચ યોગેન્દ્ર સ્વામીના નામે રહેલ સર્વે નં.૩૧૪, શ્રી ક્લ્યાણેશ્વર નગર-૨ પૈકી પ્લોટનં. ૧૦૯ ર્થ ૧૧૬/૧૩, ભુજ, કચ્છ ક્ષેત્રફળ ૯૫.૯૨ ચો.મી. જિલ્લો કચ્છ, ગુજરાત રાજ્ય ખાતે આવેલ સ્થાવ મિલકતના તમામ ભાગ અને હિસ્સા. મિલકતની **ચતુઃસીમાઃ ઉત્તરઃ** પ્લોટનં ૧૦૯ થી ૧૧૬/૧૪, **દક્ષિણ** .લોટનં. ૧૦૯ થી ૧૧૬/૧૨, **પુર્વ :** ૭.૫૦ મીટર પહોળો અંદરનો રોડ , **પશ્ચિમઃ** પ્લોટ નં. ૧૧૭ થી ૧૨૭/૧૩ બેંકના જાણમાં હોય તેવા બોજા, સ્થાનિક સરકારી, મિલક્ત પર કોઈ બોજો નથી. અહીં દર્શાવેલ ઇલેક્ટ્રીસીટી, મિલકત વેરા, મ્યુન્સિપલ ટેક્સ વિગતો અધિકૃત અધિકારીની શ્રેષ્ઠ જાણકારી અન વગેરેના બાકી લેણાં, જો કોઇ હોય તો , માહીતી હેઠળ છે. દેવાદાર(રો)નું નામ શ્રી આચાર્ચ યોગેન્દ્ર સ્વામી શ્રી આચાર્ચ યોગેન્દ્ર સ્વામી (દેવાદાર/ગીરવેદાર) પ્રમીનદાર / ગીરવેદાર(રો)ના નામ તક્ષશીલા આશ્રમ રોડ, ગામ- કુકમા, તાલુક ભુજ , જિલ્લો કચ્છ . સિક્ચોર્ડ લેણાંની રકમ રૂા. ૪૦૮७७૯૯.૦૦/- માંગણા નોટીસ ૨૮.૦૮.૨૦૧૯ મુજબ, વત્તા વસુલાતની તારીષ્ સુધીનું વ્યાજ,કોસ્ટ,ચાર્જઅને અન્ય ખર્ચ. इा. १०,५५,०००/-ਦੀਲਰੀ ਭਿੰਸਰ रीअर्प किंभतना १० टक्ता એટલે के ३१.१,०५,६००/-અર્નેસ્ટ મની ડિપોઝીટ ૧૮.૧૨.૨૦૨૦ ના રોજ સાંજે ૪.૦૦ વાગ્યા સુધી પ્રોસેસ કમ્પલાયન્સ ફોર્મ તેમજ ઈએમડીની ૨ક સુપરત કરવાની છેલ્લી તારીખ અને સમર https://www.mstcecommerce.com મારફત ઈ-હરાજી ઈચ્છુક બીડરો એઈએમડી તારીપ ના રોજ અથવા તે પહેલા રજીસ્ટ્રેશન પુર્ણ કરવાન રહેશે અને ગ્લોબલ એકાઉન્ટમાં ઈએમડી બેલેન હોવ જરૂરી છે. ર્ડ-હરાજીની તારીખ અને સમય ૨૧.૧૨.૨૦૨૦ ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યા થ બપોરે ૩.૦૦ વાગ્યા સુધી. અમર્યાદિત લંબાણ સહીત. બીડ વૃદ્ધિની રકમ રૂા. ૧૦,૦૦૦/- છે. વધુ વિગતો અને શરતો અને નિયમો ઢાઈનલો વધુ વિગતો, શરતો અને નિયમો માટે, સપંર્ક શ્રી અજય કુમાર, ચીફ મેનેજર કરવા માટે મુલાકાત લેવી : મો. : ૯૪૫૮૨૧૮૫૯૬ https://www.indianbank.in

in, zoahmedabad@indianbank.co.in **ાાલું ૧ઃ બીડર/ ખરીદાર રજાસ્ટ્રેશનઃ** બીડરે તેમના મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડીનો ઉપયોગ કરીને િકરાજી પોર્ટલ (ઉપર આપેલ લિંક) http://www.mstcecommerce.com (એટલે nttps://www.mstcecommerce.com/auctionhome/ibapi/) પર રજીસ્ટર કરાવું.

I. https://www.mstcecommerce.com

III. https://www.ibapi.in

ยभิยต:zoahmrecovery@indianbank.co.

ાગલું ૨ : કેવાયસી ચકાસણી : બીડરોએ આવશ્યક કેવાયસી દસ્તાવેજો અપલોડ કરવા. કેવાયર્સ . વેજોની ઈ-હરાજી સર્વિસ પ્રદાતા દ્વારા ચકાસણી કરવામાં આવશે.(જેમાં બે ચાલુ દિવસ લાગી શકે છે.) **પગલું ૩ : તેમના ગ્લોબલ ઇએમડી વોલેટમાં ઇએમડી ટ્રાન્સફર કરવી :** ઇ-દરાજુ પોર્ટલ પર બનાવેડ ચાલનનો ઉપયોગ કરીને એનઇએફ્ટી/ટ્રાન્સફરનો ઉપયોગ કરીને ફંડનું ઓનલાઇન / ઓફલાઇન ટ્રાન્સફર ગલા ૧ થી પગલા ૩ સુઘીની પ્રક્રિયા બીડ-રોએ ઈ-હરાજીની તારીખ પહેલા અગાઉથી પુર્ણ કરવી જોઇએ. તારીખઃ ૧૧.૧૧.૨૦૨૦ દલ્લિટ્સન ભેં અદ્યિકૃત અદ્યિકારી



કલ મ ૧૩(૨) હેઠળ નો ટીસ નીચેના દેવાદારોએ **રેપ્કો હોમ ફાયનાન્સ લીમીટેડ, અમદાવાદ શાખા** પાસેથી નીચે જણાવેલ લોનો મેળવી હતી. નીચે જણાવેલ દેવાદારોર્ન લોનો (કોલમ નં. ૩) ને (કોલમ નં.પ)માં જણાવેલ મિલકતોના મોર્ગેજ્ડ દ્વારા સિક્યોર્ડ કરાઇ છે. લોન કરારોની શરતો અને નિયમોન ાલન કરવામાં તેઓ નિષ્ફળ થયા હોર્વાથી અને લોન અનિયમીત બની હોર્વાથી, લોનોને આરબીઆઇ માર્ગદર્શિકા અનુસાર એનપીએમાં વર્ગીકૃત કરાયા હતા. રેપ્કો હોમ ફાયનાન્સ લીમીટેડ અમદાવાદ શાખામાં તેમના બાકી લેણાંની રકમો (કોલમ નં. ૪)માં જણાવેલ છે. આ રકમ જણાવેલ કરમ ઉપર અન્ય આજ અને ખર્ચ સહીત લાગુ હોય તે અનુસાર પણ ચુકવવા પાત્ર રહેશે અને તે તેમની લાગતી વળગતી તારીખોથી લાગુ ચાર્જને આયિન રહેશે.

4

1 2

ક્રમ	શાખા	દેવાદાર અને જામીનદાર	મોકલાચેલ ૧૩(૨) નોટીસ અનુસાર બાકી લેણાંની રકમ	સિક્ચોર્ડ એસેટની વિગતો
1	શાખા એક્ષઉન્ટનં. ૧૭૭૧૮૭ ૯૦,૦૦૦/- માટે તારીખ ૩૦-૦	શ્રી જોગેશ જગદીશભાઇ ચૌહાણ -દેવાદાર જે જગદીશભાઇના પુત્ર, નં. એચ/૩૦૪, ૩જો માળ, મારૂ તિનંદન એવન્યુ, વિદ્યાપીઠ સામે, રૂપાલ રોડ, રાધેજા, ગાંધીનગર-૩૮૨ ૬૨૦. અહીં પણ: ફેબ્રીકેશન વર્ક, અલિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પાણીની ટાંકી પાછળ, એ કોલોની પાસે, મહાકાળી મંદિર રોડ, દુધેશ્વર, શાહીભાગ, અમદાવાદ ૩૮૦ ૦૦૪. શ્રીમતી હેતલબેન ચૌહાણ-સહ-દેવાદાર જોગેશ જગદીશભાઇ ચૌહણના પત્ની, નં. એચ/૩૦૪, ૩જો માળ, મારૂતિનંદન એવન્યુ, વિદ્યાપીઠ સામે, રૂપાલ રોડ, રાંધેજા, ગાંધીનગર-૩૮૨ ૬૨૦.	03.0૨.૨૦૨૦ ના રોજ ફા. ૧૬,૭૦,૩૨ <i>૭</i> /– + ત્યાજ અને ખર્સ	બ્લોક નં. એચ/૩૦૪, ત્રીજો માળ, ક્ષેત્રફળ અંદાજીત ૧૧૮ ચો.ચાર્ડ (૯૮.૬ ચો.ચી.) અને જમીનનો ન વહેચાયેલ હિસ્સો ૪૭.૪૯ ચો.ચી., તેમજ તેના પરનું બાંધકામ, મારૂતિનંદન એવન્યુ તરીકે જાણીતી સ્ક્રીમમાં, અને સર્વે નં.૩૬૦ (જુનો સર્વે નં. પ૨૨) સર્વે ૩૫૯ (જુનો સર્વે નં. પ૨૨) સર્વે ૩૫૯ (જુનો સર્વે નં. પ૨૪/૧) અને સર્વે નં.૩૬૧ (જુનો સર્વે નં. પ૨૪/૨) ખાતેની જમીન પ૨ મોજે રાંધેજા, પેટા જિક્ષો અને તાલુકો ગાંધીનગર ખાતે આવેલ સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા અને ચતુઃસીમાઃ નીચે મુજબ છેઃ પુર્વઃ સીડીઓ, પેસેજ, ફ્લેટ નં. એ/૩૦૧, પશ્ચિમઃ ફ્લેટ નં. આઇ/૩૦૪, ઉત્તરઃ કોમન પ્લોટ નં.૧૬/૩૦૩

કાશનની તારીખશી ૬૦ દિવસની અંદર અ રા તરફી તમારા સંપુર્ણ બાર્ક ાંમાંથી છુટકારો મેળવવા તમને જણાવીએ છીએ જેમાં નિષ્ફળ જતા અમે ઉપર જણાવેલ સિક્યોર્ડ એસેટો સામે સિક્યોરીટાઇઝેશન અને ી કન્સ્ટક્શન એક કાયનાન્સિયલ એસેટસ અને એન્કોર્સમેન્ટ ઓક સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ. ૨૦૦૨ ની કલમ ૧૩ હેઠળ સત્તાનો ઉપયોગ રીશું. કાયદાની કલમ ૧૩ હેઠળ અને ઉપલબ્ધ સત્તાઓની સાથે સાથે (૧) દેવાદારની સિક્યોર્ડ એસેટનો કબજો લેવાની સત્તા જેમાં સિક્યોર્ડ બેસેટ છોડાવા માટે ભાડે, વેચાણની સોંપણીના માર્ગે ફેરબદલીના હકોનો સમાવેશ થાય છે, (૨) સિક્યોર્ડ એસેટના વ્યવસ્થાપન પર કબજે જેમાં ભાડ, સોંપણી અથવા વેચાણવાને કરળદીલી અને સિક્કોર્ડ એસેટને છોડવાના હકોનો સમાવેશ થાય છે અને અમારા દ્વારા સિક્યોર્ડ એસેટની કોઇપણ તબદીલી દ્વાન્યકરીને અથવા જો તબદીલી તમારા તરફથી કરાયેલ હોય તો પણ સિક્યોર્ડ એસેટના સબંધમાં તમામ હકો સુપરત કરશે. અમે સિક્યોરીટાઇઝેશન એક્ટની કલમ ૧૩(૮) પ્રત્યે તમારું ધ્યાન દોરીએ છીએ, જે અનુસાર જો સિક્યોર્ડ ક્રેડીટરના બાકી લેણાં સિક્યોર્ડ . કેડીટર દ્વારા લદાયેલ તમામ મુલ્યો, ચાર્જ અને ખર્ચાઓ સહીત તમારા દ્વારા સિક્યોર્ડ એસેટના વેચાણ અથવા તબદીલીની નક્કી કરેલ તારીખ પહેલા કોઇપણ સમયે ભરપાઇ કરવામાં આવે છે તો સિક્યોર્ડ એસેટની તબદીલી અથવા વેચાણ માર્ટ કોઇ અન્ય પગલાં લેવામાં આવશે નહી.

તારીખ : ૦૩.૦૨.૨૦૧૯ (સરફૈસી એક્ટ ૨૦૦૨), રેપ્કો હોમ ફાયનાન્સ લીમીટેડ.

સદ્ભાવ એન્જીનિયરીંગ લીમીટેડ



[CIN: L45400GJ1988PLC011322] **૨૪૪૨૨ર્ડ ઓફીસ**: સદ્ભાવ હાઉસ, લો ગાર્ડન પોલીસ ચોકી સામે, એલિસબ્રીજે, અમદાવાદ–૩૮૦૦૦૬, ગુજરાત **होन** : ६९ ७६ ४०४००४००, **हेड्स** : ६९ ७६ ४०४००४४४ ยายส: investor@sadbhav.co.in dorสเยะ: www.sadbhaveng.com

સભ્યોને પોસ્ટલ બેલોટ નોટીસ

ભાવ એન્જીનિયરીંગ લીમીટેડ (અહી પછી''કંપની '' તરીકે દર્શાવેલ છે) ના સભ્યોને જાણ કરવામાં આવ છે કે કંપની કાયદા,૨૦૧૩ ની કલમ ૧૦૮ અને કલમ ૧૧૦ ની જોગવાઇઓ અને કંપની (વ્યવસ્થાપ_' બને પ્રશાસન) નિયમો, ૨૦૧૪ ના સુધારેલ નિયમ ૨૦ અને ૨૨ અને સિક્યોરીટીઝ અને એક્સચેન્જ બો ઓફ ઇન્ડિયા (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વાયરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૪૪ અન્વયે તેમજ કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા જારી કરાયેલ પરિપત્ર નં ૧૪/૨૦૨૦, તારીખ ૦૮ એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ તા. ૧૩ એપ્રિલ, ૨૦૨૦ અને પરિપત્ર નં.૨૦/૨૦૨૦ તા. ૦૫ મે, ૨૦૨૦, પરિપત્ર નં.૨૨/૨૦૨૦, તા.૧૫ જુન, ૨૦૨૦,પરિપત્ર નં. ૩૩/૨૦૨૦ તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ અને સિક્યોરીટી એક્સચેન્જ[ે] બોર્ડ ઓફ ઇન્ડિયા એ તેના પરિપત્ર નં SEBI/HO/CFD/CMD1/CIR/P//2020/79 તા. ૧૨ મે, ૨૦૨૦ (પરિપત્રો), કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (એમસીએ).ભારત સરકાર અને સિક્યોરીટી અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ તમામ અન્ય લાગુ કાનુનો અને પરિપત્રો અનુસા૨ કંપની દ્વારા સામાન્ય ઠરાવના માર્ગે પાસ કરવાના નીચેના કાર્યો માટે પોસ્ટલ બેલોટ (ફક્ત રીમોટ ઇ-વોટીંગ મારકત) દ્વારા કંપનીના સભ્યોની મંજુરી મંગાવવામ

૧.શ્રી વિપુલ એચ. પટેલ, શ્રી ગીરીશભાઇ એન. પટેલ, શ્રીમતી રાજશ્રી પ્રિતમ પટેલ, શ્રીમતી તૃપ્તિબેન્ નેલેશભાઇ પટેલનું પ્રમોટર અને પ્રમોટર્સ ગૃપમાંથી પબ્લીક કેટેગરીમાં પુર્ન વર્ગીકરણ.

પનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે શ્રી રવિ કપુર, મેસર્સ રવિ કપુર એન્ડ એસોસિયેટ્સના વ્યવસાયિક કંપર્ન સેક્રેટરી અને પ્રોપરાયટર (સભાસદ નં. એફસીએસ-૨૫૮૭) (સ્ક્રુટીનાઇઝ૨) ની યોગ્ય અને પારદર્શક ાદ્ધતિમાં પોસ્ટલ બેલોટના સંચાલન માટે સ્ક્રુટીનાઇઝર તરીકે નિમણુક કરી છે. એલઓડીઆર નિયમનોની ઝાવશ્કતાઓ હેઠળ કંપનીએ તેના સભ્યોને ઇલેક્ટ્રોનિક વોટીંગની સવલત આપવા માટે સેન્ટ્રલ ડિપોઝીટરી યર્વિસીઝ (ઇન્ડિયા) લીમીટેડ (સીડીએસએલ) ની નિમણુક કરી છે.

કટ-ઓફ તારીખ એટલે કે રવિવાર, ૮ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ ફીઝીકલસ્વરૂપે અથવા ડિમટીરીયલાઇઝ સ્વરૂપે શેરો ધરાવતા કંપનીના સભ્યો, સોમવાર, ૧૪ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યા સુધી તેમના મતો આપી શકે છે. ત્યારબાદ મતદાન માટે રીમોટ ઇ-વોટીંગ સવલત બંધ કરવામાં આવશે પોસ્ટલ બેલોટ નોટીસ ન મળી હોય તેવા કિસ્સામાં કટ–ઓફ તારીખ ના રોજ સભ્યો હોય તેવો કંપનીની વેબસાઇટ www.sadbhaveng.com અથવા સીડીએસએલની વેબસાઇટ એટલે www.evotingindia.com અથવા પરથી તે ડાઉનલોડ કરી શકે છે અથવા કંપનીને અરજી કરી શકે છે. પોસ્ટલ બેલોટ નોટીસના ભાગરૂપે રીમોટ ઇ-વોટીંગ માટેની વિગતવાર પ્રક્રિયાના સુચનો નીચે મુજબ છેઃ

૧. જે શેરહોલ્ડરોએ તેમના ઇમેઇલ આઇડી કંપની / ૧૩ નવેમ્બર,૨૦૨૦

	ડિપોઝીટરી/રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ (આરટીએ)	
	પાસે રજીસ્ટર્ડ કરાવ્યા છે તેમને ઇમેઇલથી પોસ્ટલ	
	બેલોટ નોટીસની રવાનગી પુર્ણ કર્યાની તારીખ.	
	જો કે કોવીડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખીને પોસ્ટલ	
	બેલોટ નોટીસની હાર્ડ નકલ તેમજ પોસ્ટલ બેલોટ	
	ફોર્મ અને પ્રી-પેઇડ બિઝનેશ રિપ્લાય એન્વેલોપ આ	
	પોસ્ટલ બેલોટ માટે સભ્યોને મોકલવામાં આવશે નહી	
	અને શેરહોલ્ડરોએ તેમની સંમતિ અથવા અસંમતિ	
	ફક્ત રીમોટ ઇ-વોટીંગ પદ્ધતિથી જણાવાની રહેશે.	
٦.	રીમોટ ઇલેક્ટ્રોનિક વોટીંગના શરૂઆતની	રવિવાર, ૧૫ નવેમ્બર ,૨૦૨૦ ના રોજ
	તારીખ અને સમય	સવારે ૦૯.૦૦ કલાકે
з.	રીમોટ ઇલેક્ટ્રોનિક વોટીંગ પુર્ણ	સોમવાર, ૧૪ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ
	થવાની તારીખ અને સમય	સાંજે ૫.૦૦ કલાક સુધી
٧.	સભ્યોના મતદાન હકો નક્કી કરવા	રવિવાર, ૦૮ નવેમ્બર, ૨૦૨૦
	માટેની કટ-ઓફ તારીખઃ	
૫.	પોસ્ટલ બેલોટની નોટીસ કંપનીની વેબસાઇટ અને	www.sadbhaveng.com;
	સીડીએસએલની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશેઃ	www.evotingindia.com
٤.	પોસ્ટલ બેલોટને લગતા કોઇપણ પ્રશ્નો	શ્રી તુષાર શાહ, કંપની સેક્રેટરી,
	અથવા ફરિયાદો :	ટેલીઃ ૦૭૯ ૪૦૪૦૦૪૦૦
		ઇમેઇલ : <u>investor@sadbhav.co.in</u>
૭.	ઇ-વોટીંગને લગતા કોઇપણ પ્રશ્નો અથવા ફરીયાદો	જો તમને ઇ-વોટીંગને સંબંધિત કોઇ પ્રશ્નો
		અથવા સમસ્યાઓ છે તો તમે હેલ્પ સેક્શન
		હેઠળ <u>www.evotingindia.com</u> પર
		ઉપલબ્ધ વારંવાર પુછાતા પ્રશ્નો
		(એફએક્યુએસ) અથવા ઇ-વોટીંગ
		મેન્યુઅલ જોઇ શકો છો અથવા
		helpdesk.evoting@cdslindia.com
		પર ઇમેઇલ કરી શકો છો અથવા
		૧૮૦૦૨૨૫૫૩૩ ઉપર ક્રોલ કરી શકો છો.
		ઇલેક્ટ્રોનિક માધ્યમોથી મતદાન સાથે

૮. પોસ્ટલ બેલોટ દ્વારા ઇ-વોટીંગના પરિણામો બુધવાર, ૧૬ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ કંપનીની કોર્પોરેટ ઓફીસ ખાતે સદભાવ, હેવમોર રેસ્ટોરન્ટ પાસે, નવરંગપુરા બસ સ્ટેન્ડ પાછળ, અમદાવાદ-૩૮૦૦૦૯ ગુજરાત ખાતે જારી / જાહેર કરવામાં આવશે. પરિણામો તેમજ સ્ક્રુટીનાઇઝરનો અહેવાલ કંપનીની વેબસાઇટ એટલે કે <u>www.sadbhaveng.com</u> અને સીડીએસએલની વેબસાઇટ એટલે www.evotingindia.com પર મુકવામાં આવશે. આ સિવાય કંપનીના શેરો જ્યાં લિસ્ટેડ છે તે સ્ટોક એક્સચેન્જોને પણ જાણ કરવામાં આવશે.

બોર્ડના આદેશર્થ સદ્ભાવ એન્જીનિચરીંગ લીમીટેડ સહી/-કંપની સેક્રેટરી સભાસદ નં. એફ૭૨૧૬

સંકળાયેલ કોઇપણ ફરિયાદ શ્રી રાકેશ

દલવી. મેનેજર, સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ (ઇન્ડિયા) લીમીટેડ, એવિંગ,

૨૫મોમાળ, મેરેથોન ફ્યુચરેક્સ, મકતલાલ મીલ કંપાઉન્ડ. એન.એમ. જોષી

માર્ગ, લોઅર પારેલ (પુર્વ), મુંબઇ

૪૦૦૦૧ ૩ને જણાવી શકાશે અથવા

helpdesk.evoting@cdslindia.com પર ઇમેઇલ રી શકો છો અથવા

૧૮૦૦૨૨૫૫૩૩ ઉપર ક્રોલ કરી શકો છો

BLUE HORIZON INVESTMENTS LIMITED

તારીખ: ૧૩ નવેમ્બર, ૨૦૨૦

સ્થળ: અમદાવાદ

CORPORATE IDENTITY NO. L99999MH1974PLC127031

Regd. Office: Ballarpur Paper Mills, P.O. Ballarpur – 442901, Dist. Chandrapur, Maharashtra

STATEMENT OF UNAUDITED / AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30 SEPTEMBER, 2020

De In Lakhe

		Rs. In La							
SI. No.	Particulars	Quarter ended 30.09.2020 (Unaudited)	Quarter ended 30.06.2020 (Unaudited)	Quarter ended 30.09.2019 (Unaudited)	Half year ended 30.09.2020 (Unaudited)	Year Ended 31.03.2020 (Audited)			
	Part -1								
1.	Total Income from Operations	1.91	1.91	1.91	3.83	7.65			
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	(1.06)	(0.91)	(1.08)	(1.97)	(6.54)			
3.	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary items)	(1.06)	(0.91)	(1.08)	(1.97)	(6.54)			
4.	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary items)	(1.06)	(0.91)	(1.08)	(1.97)	(6.54)			
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	(1.06)	(0.91)	(1.08)	(1.97)	(6.55)			
6.	Equity Share Capital	5.01	5.01	5.01	5.01	5.01			
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of previous year					308.91			
8.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)								
	1. Basic:	(2.12)	(1.81)	(2.16)	(3.93)	(13.06)			
	1. Diluted:	(2.12)	(1.81)	(2.16)	(3.93)	(13.06)			

- a) The above Financial Results for the quarter ended September 30, 2020 have been prepared as per Ind AS rules and reviewed and recommended by the Audit committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on November 13, 2020 and the Statutoty Auditors of the Company have provided Limited Review Report for the detailed Unaudited Financial Results.
- The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The Full format of the Quarterly/ Annual Financial Results are available on the websites of the stock Exchange(s) and the listed entity. (www.bhil.co.in).

For Blue Horizon Investments Ltd.

Place : Gurugram Dated: 13.11.2020 **CFO**